

# Book Review

# પુસ્તક સમીક્ષા

S.V. College of Education, Kadi  
Soorajba College of Education, Kadi.

# પુસ્તક સમીક્ષા એટલે શું?

- સમીક્ષા : કોઈપણ લખાણ , બનાવ, વસ્તુ કે ઘટનાનું સમીક્ષાત્મક મૂલ્યાંકન
- પુસ્તક સમીક્ષા એ એક પુસ્તકનું વિશ્લેષણ છે જેમાં તેનું વિષયવસ્તુ , ખાસિયતો , નબળાઈઓ અને સંદર્ભો સામેલ છે.
- પુસ્તક સમીક્ષા એ એક પ્રક્રિયા છે જેના દ્વારા સમીક્ષક પુસ્તકની શૈલી, સામગ્રી અને મૂલ્ય દ્વારા વિશ્લેષણ કરીને વિવેચન કરે છે.
- કોઈપણ પ્રકારના લેખ કે પુસ્તકની સમીક્ષા થઈ શકે

# પુસ્તક સમીક્ષા શા માટે ?

- ❑ પુસ્તક સમીક્ષા સંભવિત વાચકો માટે માર્ગદર્શિકા છે. સંક્ષિપ્તમાં કઈ સમીક્ષા લેખકની ખાસિયતો અને મુખ્ય મુદ્દાઓને તે સારાંશ સ્વરૂપે રજૂ કરે છે. સમીક્ષક પોતાના અભિપ્રાય દ્વારા લેખક પોતાની વાત / મુદ્દાઓ અંગે વાચકોને સમજાવવામાં સફળ થાય છે કે નહીં તે પણ રજૂ કરે છે .
- ❑ સમીક્ષાનું મુખ્ય અને મહત્વનું તત્વ વિવરણ કે ચર્ચા (ટીકા ટીપ્પણી)
- ❑ તમે લેખકના વિચારો સાથે સંમત કે અસંમત થઈ શકો અને પુસ્તક ઉદાહરણરૂપ છે કે તેમાં જ્ઞાન , રજૂઆત કે વિચારની દ્રષ્ટીએ કોઈ ખામી છે તે અંગે તમારો સ્પષ્ટ અભિપ્રાય આપી શકો

# પુસ્તકના પ્રકાર

- પુસ્તકના ઘણી બધી દ્રષ્ટીએ ઘણા પ્રકાર પડી શકે . પરંતુ સમીક્ષા માટે પુસ્તકના વિષય વસ્તુને આધારે મુખ્ય બે વિભાગમાં વહેંચી શકાય .

## 1. Fiction(કથા સાહિત્ય સ્વરુપ)

(લેખકની કલ્પના પર આધારિત લઘુ કથાઓ, નવલકથાઓ, દંતકથાઓ, લોક કથાઓ અને પરીકથાઓ બધી કાલ્પનિક સાહિત્ય ગણાય )

## 2.Non Fiction (બિન કથા સાહિત્ય સ્વરુપ)

(નોનફિક્શન વિભાગમાં આત્મકથા ,જીવનચરિત્ર, વ્યવસાય, રસોઈ, આરોગ્ય અને માવજત,પાળતુ પ્રાણી,હસ્તકલા, ઘર સજાવટ, ભાષાઓ, પ્રવાસ વર્ણન, વ્યક્તિત્વ વિકાસ , ધર્મ, કલા અને સંગીત, ઇતિહાસ,સત્ય બનાવો આધારિત અપરાધ, વિજ્ઞાન , વાણિજ્ય અને રમૂજ વગેરે ને લગતા પુસ્તકો )

# પુસ્તક સમીક્ષા લખતા પહેલા.....

- પુસ્તકની પસંદગી ખૂબ મહત્વની
- ખૂબ કાળજીપૂર્વક પુસ્તક વાંચો.
- તમે જે અનુભવો છો એ નોંધો.
- પુસ્તક સમીક્ષા લખવાની કોઈ ચોક્કસ અને નિશ્ચિત પદ્ધતિ નથી
- પરંતુ લખાણ લખતા પહેલા કાર્ય પર સમીક્ષાત્મક વિચારણા થવી જરૂરી છે

# પુસ્તક સમીક્ષા લખતા પહેલા.....

- સમીક્ષાત્મક વિચારણા માટે નીચેના પ્રશ્નો તમને મદદરૂપ થઈ શકશે.
  - 1) પુસ્તકનો મુખ્ય વિચાર : મુખ્ય વિચાર શું છે? સાંપ્રત સમાજની વિચારસરણી કે અન્ય કોઈ બાબત તમે જાણતા હોવ તેની સાથે સામ્યતા ધરાવે છે કે વિરુદ્ધ વિચારસરણી ધરાવે છે? કઈ બાબતો પુસ્તકને પરિપૂર્ણતા આપે છે?
  - 2) પુસ્તકનો વિષય કે મુદ્દો શું છે: શું વિષય વસ્તુ યોગ્ય પ્રમાણમાં આવરી લેવાયું છે? શું લેખકે વિષયના બધા પાસાઓ સંતુલિત રીતે આવરી લીધા છે? કયો અભિગમ અપનાવેલ છે? (સ્થાનિક , વિશ્લેષાત્મક , કાળ ક્રમિક કે વર્ણનાત્મક )
  - 3) લેખકે પોતાની દલીલો રજૂ કરવા શેનો આધાર લીધો છે: પોતના મુદ્દા રજૂ કરવા કયા પુરાવા લીધેલ છે? તમે તેની સાથે સંમત છો કે નહિ ? તમે વાંચેલ કોઈ અન્ય પુસ્તક કે લેખ સાથે પુસ્તક સાથે વિરોધી વિચારસરણી ધરાવે છે?

# પુસ્તક સમીક્ષા લખતા પહેલા.....

- 4) લેખકે પોતાની દલીલોનું માળખું કેવી રીતે વ્યક્ત કરેલું છે: વિવિધ ભાગોને સાંકળીને એક આખો વિચાર ઉભો કરી શક્યા છે? શું તે દલીલો અર્થપૂર્ણ છે? શું આ સમજ સાથે તમે સંમત છો? શા માટે / શા માટે નહિ?
- 5) તમને આ પુસ્તક વિષય સમજવામાં કેવી રીતે ઉપયોગી બન્યું

# પુસ્તક સમીક્ષાનું માળખું

## A - Introduction (પ્રસ્તાવના/ પરિચય)

- ❑ લેખકનું નામ , પુસ્તકનું નામ , પ્રકાશક , લેખકનું નામ
- ❑ પાનાંની સંખ્યા , કિંમત , ISBN નંબર જેવા બાહ્ય લક્ષણો (ખૂબ ટૂંકમાં )
- ❑ લેખકનો અતિ સંક્ષિપ્ત પરિચય અને જે તે ક્ષેત્રમાં પ્રદાન
- ❑ પુસ્તક તમે શા માટે પસંદ કર્યું ?
- ❑ મુખ્ય થીમ / વિષય (અતિ ટૂંકમાં – 4-5 લીટીમાં )
- ❑ સંભવિત વાચક ગણ (Targeted Readers)

# પુસ્તક સમીક્ષાનું માળખું

## B - Summary of Content (વિષયવસ્તુનો સારાંશ)

- ❑ વિષય વસ્તુને માત્ર ટૂંકમાં રજૂ કરવાનું નથી પરંતુ ...
- ❑ લેખકના મુખ્ય વિચાર કે હેતુને પ્રતિનિધિત્વ આપી શકે તેવી રીતે રજૂ કરવું .
- ❑ પુસ્તક અંગેનું તમારું વર્ણન વાંચનારને લેખકના વિચારો અને હેતુઓની સમજ આપી શકે તે રીતે રજૂ થવું જરૂરી
- ❑ Fiction(કથા સાહિત્ય સ્વરુપ) માટે પ્લોટ /મધ્યવર્તી વિચાર - પાત્ર પરિચય - લેખન શૈલી -
- ❑ Non Fiction (બિન કથા સાહિત્ય સ્વરુપ)માટે ષય વસ્તુ , લેખકે પુસ્તકમાં રજૂ કરેલ મુદ્દા અને તેની ગોઠવણ તેમજ આધાર રુપ બાબતો , તેની માવજત ,
- ❑ પુસ્તકના બૌદ્ધિક , સંવેગિક અને સૌન્દર્ય લક્ષી ગુણ

# પુસ્તક સમીક્ષાનું માળખું

## C - પુસ્તકનું વિશ્લેષણ અને મૂલ્યાંકન

- ❑ પુસ્તક સમીક્ષાનો સૌથી લાંબો અને મહત્વનો ભાગ
- ❑ ફકરા સ્વરૂપે અને એક સમયે એક જ બાબત રજૂ થવી જોઈએ.
- ❑ લેખકનો હેતુ શું છે?
- ❑ વિચાર સંકલન ( રજૂઆતની પદ્ધતિ- ચોકસાઈ - યોગ્યતા )
- ❑ શું લેખક પોતાની વાત/ વિચાર યોગ્ય રીતે રજૂ કરી શક્યા છે કે કેમ??
- ❑ શું લેખકે વિષયના બધા પાસાઓ સંતુલિત રીતે આવરી લીધા છે?
- ❑ તમે તેમના વિચારો સાથે સંમત છો કે કેમ ? ( મધ્યવર્તી વિચાર કે પાત્રોની સામાજિક / માનસિક પૃષ્ઠભૂમિ / વિકાસ )

- ❑ શું લેખકનો હેતુ સિદ્ધ થયો છે
- ❑ શું ખ્યાલો સારી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે?
- ❑ શું ભાષા સ્પષ્ટ અને લોકભોગ્ય છે?
- ❑ શું વિચારો વિકસિત થયા છે?
- ❑ કયા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે, આવરી લેવામાં આવ્યાં નથી?
- ❑ માહિતી કેટલી સચોટ છે?
- ❑ અન્ય લેખકોના આજ વિષય વસ્તુ પર આધારિત પુસ્તક/લેખ/વિચારસરણી સાથે સરખામણી
- ❑ લેખકના અન્ય પુસ્તક સાથે સરખામણી

# પુસ્તક સમીક્ષાનું માળખું

## D- Conclusion (સમાપન)

- ❑ પુસ્તકની તમારા પર પડેલી અસરો
- ❑ સાંપ્રત સમય સાથે અનુબંધ ધરાવે છે ?
- ❑ પુસ્તક અંગેનો તમારો આખરી અભિપ્રાય (અહીં કોઈ નવી વાત કે વિચાર ના આવવો જોઈએ તેમજ પુસ્તકની સારી અને નબળી બાબતો વચ્ચે સંતુલન હોવું જોઈએ)
- ❑ અન્ય વાચકોને વાંચવા માટે ભલામણ કરશો? (જો હા તો શા માટે ? જો ના તો શા માટે ?)

આપના પ્રશ્નો આવકાર્ય

આભાર